

Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

CIN: L24110GJ1976PLC002903

An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company

P.O Narmadanagar - 392015, Dist. Bharuch, Gujarat, India Ph. (02642) 247001, 247002 Website: www.gnfc.in

No. SEC/BD/SE/AGM September 14, 2024

Dy. General Manager The Manager

BSE Limited Listing Department

Corporate Relationship Dept., National Stock Exchange of India Limited

1st Floor, New Trading Ring, Exchange Plaza, Rotunda Bldg., C-1, Block - "G",

PJ Towers, Dalal Street, Fort, Bandra-Kurla Complex, Bandra (E),

Mumbai - 400 001 Mumbai - 400 051 Scrip Code: "500670" Symbol: "GNFC"

Sub.: Newspaper publication in respect of Addendum to Notice of 48th Annual General Meeting & e-voting information

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper clippings of the advertisement published in the below mentioned newspapers regarding Addendum to Notice of 48th Annual General Meeting & e-voting information

- 1. Ahmedabad Edition of "Business Standard" and
- 2. Vadodara Edition of "Loksatta Jansatta"

The advertisement is also being made available on the Company's website at www.gnfc.in.

We request you to kindly take note of the above.

Thanking you.

Yours faithfully,

For Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

Chetna Dharajiya

Company Secretary & Chief Manager (Legal)

Encl.: As above

The Kalupur Commercial Co-op. Bank Ltd.

Ph: 27582020 to 27582026 Fax: 079-27582033, 27544450

H.O.: "Kalupur Bank Bhavan." Nr. Income Tax Circle, Ashram Road, Ahmedabad-14

SALE OF PROPERTY THROUGH E-AUCTION SALE OF IMMOVABLE ASSETS IN POSSESSION OF BANK UNDER THE SECURITISATION & RECONSTRUCTION OF FINANCIAL ASSETS & ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002 READ WITH PROVISION TO RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES-2002.

Notice is here by given to the public in general and in particular to the borrower(s) and guarntor (s) that the below discribed immovable propert mortgaged/charged to the secured creditor, the physical possession of which has been taken by the Authorised officer of The Kalupur Comm. Co Op. Bank Ltd, will be sold on "As is where is " and ,"What ever There is" basis on 22/10/2024, for recovery of Rs. 3,74,20,412.37 and Rs 3.86.98.731.58 due to the bank from M/s. Sharma Radio Center & M/s. Sharma Eletronics respectively (Borrower) and Mrs. Shartidey Saraschandra Sharma Mr. Krishna Saraschandra Sharma and Mr. Ashok Saraschandra Sharma (Guarantor).

Offers are invited in sealed cover so as to reach the Authorized Officer on or before dtd.21/10/2024 for the sale of the below property in the Physical possession of the bank on "As is where is basis & whatever there is basis" towards the recovery of its secured debts with interests costs, charges etc. from borrowers as stated hereunder

Sr. No.	Borrower Name	Secured Debt for Recovery	Description of Properties	Reserve Price Rs.	EMD Rs.
1.	M/s. Sharma Radio center (Borrower) Prop. Krishna Saraschandra Sharma 1. Mr. Ashok Saraschandra Sharma (Guarantor) 2. Late Saraschandra Sharma (Guarantor) 3. Mrs. Shantidevi Saraschandra Sharma (Guarantor)	As per Sec-13(2) demand notice dtd. 25/01/2024 Rs. 3,43,56,954.02 + Interest & expenses thereon	Property-1 Owner: Late Saraschandra Basantprasad Sharma Through its Legal Heirs 1.1.Mrs. Shantidevi Saraschandra Sharma (Wife) 1.2 Mr. Krishna Saraschandra Sharma (Son) 1.3 Mr. Ashok Saraschandra Sharma (Son) Property of Block /Survey No. 205/1 & 206, Shop No. 1, Anupam Amenity Center Ground floor, Near Udhna Teen Rasta, Udhna, Surat. Admeasuring 20.39 So. mtrs.	73,00,000/-	7,30,000/-
2.	M/s. Sharma Electronics (Borrower) Prop. Ashok Saraschandra Sharma 1. Mr. Krishna Saraschandra Sharma (Guarantor) 2. Late Saraschandra Sharma (Guarantor) 3. Mrs. Shantidevi Saraschandra Sharma (Guarantor)	As per Sec-13(2) demand notice dtd. 25/01/2024 Rs. 3,54,65,009.85 + Interest & expenses thereon	Property-2 Owner: Mrs. Shantidevi Saraschandra Sharma Property of Block /Survey No. 205/1 & 206, Shop No. 2, Anupam Amenity Center Ground floor, Near Udhna Teen Rasta, Udhna, Surat. Admeasuring 13.90 Sq. mtrs. Property-3 Owner: Mrs. Shantidevi Saraschandra Sharma Property of Block /Survey No. 205/1 & 206, Shop No. 3, Anupam Amenity Center Ground floor, Near Udhna Teen Rasta, Udhna, Surat. Admeasuring 10.90 Sq. mtrs.		

mportant Dates

- Site visit of property between date 18/09/2024 & time 11:00 P.M. To 5:00 P.M
- Last date for offer submission date 21/10/2024 & time 4:00 P.M. E-Auction Dt.22/10/2024 and time 11:00 A.M. to 2:00 P.M.
- Website of E-Auction for selling of property https://sarfaesi.auctiontiger.net
- More details terms of Condition for E-Auction https://sarfaesi.auctiontiger.net and www.kalupurbank.com
- For further Information of Property Contact to Shri Raiesh B. Patel Mo. No. 9925241070 and Shri Dhruvit M. Patel Mo. No. 9913772044 **Authorized Office**

Date: 11/09/2024

The Kalupur Comm. Co-op. Bank Ltd H.O. Ahmedabad - 380 014.

KG B

Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company Regd. Office: P.O.Narmadanagar - 392015, Dist.: Bharuch (Gujarat), India, CIN: L24110GJ1976PLC002903, Tel: 02642 247001, 247002, E-mail: investor@gnfc.in Website: www.gnfc.in

ADDENDUM TO THE NOTICE OF 48th ANNUAL GENERAL MEETING

This is with reference to the Notice dated August 13, 2024 sent electronically to the members on August 28, 2024, for convening 48th Annual General Meeting (AGM) of Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited ("the Company") on Friday, September 20, 2024 at 03:00 P.M. through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"), to transact the business set out therein. The said notice has been sent in due compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements)

Subsequent to the issuance of the Notice of 48th AGM, the GoG, Finance Department vide it office order no. FD/AOD/e-file/4/2022/1869/A (BPE) dated September 10, 2024, has appointed Dr. T. Natarajan, IAS (DIN: 00396367) Principal Secretary, Finance Department as a Director on Board of the Company, w.e.f. from September 11, 2024 and until further orders, vice Shri J.P. Gupta, IAS

Pursuant to Section 160 of the Companies Act, 2013 read with Rule 13 the of Companies (Appointment and Qualifications of Directors) Rules, 2014, and other applicable provisions, the Company has received notice in writing proposing the name of Dr. T. Natarajan, IAS (DIN: 00396367) as candidate for the office of Director of the Company, for consideration at the forthcoming Annual General Meeting (AGM). The said agenda would be included in the remote &voting facility commencing from Monday, September16,2024 (09:00 AM) to Thursday, September 19, 2024 (05: 00 PM) and also in the e-voting facility available during the AGM, for members to

Accordingly after due compliance of applicable laws, an addendum to the Notice of 48th AGM for additional agenda as Special Business at Item No. 7 i.e. proposal for appointment of Dr. T. Natarajan, IAS (DIN: 00396367) as a Director, along with Statement pursuant to Section 102 of the Act, has already been sent electronically to those Members of the Company whose email addresses are registered with Company/Depository Participant (DP), as on the cut-off date and it shall form an integral part of the original Notice dated August 13, 2024 of 48th AGM of the Company and the notes provided therein, for all purposes.

The said addendum is also available on the Company's website i.e. <u>www.gnfc.in</u> , website of the Stock Exchanges, i.e. BSE Limited at www.bseindia.com , National Stock Exchange of India Limited at www.nseindia.com and website of CDSL at www.evotingindia.com

For Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

Place: Bharuch Date : September 13, 2024

Chetna Dharajiya Company Secretary & CM (Legal) Government of India Ministry of Finance

Debts Recovery Tribunal-II 4rd Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram, Paldi, Ahmedabad, Gujarat FORM NO. 22 (Earlier 62) [Regulation 36 & 37 of DRT Regulations, 2015] [See Rule 52 (1) (2) of the Second Schedule to the Income Tax Act, 1961] READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993

E-AUCTION/SALE NOTICE
THROUGH REGD.AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM/PUBLICATION RP/RC No. 195/2015 O.A. No. 482/2013 ICICI BANK LIMITED ...Certificate Holder Bank

...Certificate Debtors Pravinbhai Nagjibhai Patel

To, C.D. No. 1 : Pravinbhai Nagjibhai Patel, B/1/201, Suryakiran Enclave, Bhadkodra

The aforesaid CDs No. 1 have failed to pay the outstanding dues of Rs. 40,47,613.77 (Rupees Forty Lakhs Forty Seven Thousand Six Hundred Thirteen and Seventy Seven paise only) as on 30/10/2013 including interest in terms of judgment and decree dated 29/05/2015 passed in O.A.No. 482/2013 as per my order dated 06/09/2024 the under mentioned property (s) will be sold by public e-auction in the aforementioned matter. The auction sale will be held through "online e-auction" https://www.bankeauctions.com

Lot No.	Description of the property	Reserve price (Rounded off)	EMD 10% or (Rounded off)
	All the piece and parcels of the immovable property being Flat No. B-1/201, 2nd Floor, Surya Kiran Enclave Complex, Nr. Kapodra Patia, Opp. Krishna Park Raod, Mouje: Kapodara, Tal: Ankleshwar, Diat: Bharuch (Built up area 912 sq. ft. as per valuation report)	Rs. 16.50 Lakhs	Rs. 01.65 Lakhs

Note* In respect of any claims to be received, if any, priority of payment will be decided in terms of Section 31-B of the RDB Act, 1993 (as amended in the year 2016), EMD

shall be deposited by through RTGS/NEFT in the account as per details as under:			
	Beneficiary Bank Name	ICICI Bank Ltd.	
Beneficiary Bank Address		Pudukottai	
	Beneficiary Account No.	611405013392	
	IFSC Code No.	ICIC0006114	

1) The bid increase amount will be Rs. 10,000/- for Single lot. Prospective bidders may avail online training from service provider C1 india Pvt Ltd

(Tel. Helpline No. 7291981124/1125/1126 and Mr. Bhavik Pandya (Mobile No. 8866682937), Helpline E-mail ID: support@bankeauctions.com and for any property related queries may contact Mr. Haresh Panchal, (Mob No.9898454684) 3) Prospective bidders are advised to visit website https://www.bankeauctions.com for detailed terms & conditions and procedure of sale before submitting their bids.

4) The prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after fall of hammer/close of auction and 75% within 15 days from the date of auction and if 15th day is Sunday or other Holiday, then on immediate next first bank working day. No request for extension will be entertained. 5) The properties are being put to sale on "as is where is", "as is what is" and "as is whatever" basis and prospective buyers are advised to carry out due diligence properly.
6) Schedule of auction is as under:-

ı		SCHEDULE OF AUCTION		
	1.	Inspection of property	11/10/2024 Between 11:00 AM to 2:00 PM	
	2.	Last date for receiving bids alongwith earnest money and uploading documents including proof of payment made	04/11/2024 Up to 05:00 PM	
	3.		05/11/2024 Between 12:00 PM to 01:00 PM (with auto extension clause of 03 minutes, till E-Auction ends)	
			(ANLIBHA DUBEV)	

RECOVERY OFFICER-DEBTS RECOVERY TRIBUNAL- II, AHMEDABAI

OSBI

Information Security Department, State Bank of India, Global IT-Centre, Sec-11, CBD Belapur, Navi Mumbai-400 614

REQUEST FOR PROPOSAL

Ref: SBI/GITC/ISD/2024-25/ISO/18(RFP-1255) Bids are invited by State Bank of India from the eligible bidders for Engaging competent forty-one (41) resources on Application Managed Services to work in bank environment for a period of one year-Project-II-August 2024 for State Bank of India (SBI). For details, please visit 'Procurement News' a https://bank.sbi and e-tender portal (https://etender.sbi/SBI) Commencement of download of RFP: From 10.09.2024 at 18:00 hrs

Last date and time for submission of bids: 30.09,2024 up to 14:00 hrs

Place: Navi Mumbai Date: 14.09.2024

Deputy General Manager (Cyber Security) Information Security Department

HERO HOUSING FINANCE LIMITED

Branch Office: Office No. 309, Third Floor, Nishal Centre Finance Near Nishal Circle, Pal Road, Pal,Adajan, Surat - 395009.

UNDER RULE 9(1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY MORTGAGED WITH HERO HOUSING FINANCE LIMITED(SECURED CREDITOR) UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002.

FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002.

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) or their legal heirs' representatives that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Hero Housing Finance Limited (secured creditor), will be sold on 30-Sep-2024 (E-Auction Date) on "AS IS WHERE S", "AS IS WHAT IS" and "WHATEVER HERE IS" basis for recovery of outstanding dues from below mentioned Borrowers, Co-Borrowers or Guarantors. The Reserve Price and the Earnest Money Deposit is mentioned below. The EMD should be made through Demand Draft/RTGS/NEFT for participating in the Public F-Auction along with the Bid Form which shall be submitted to the Authorised Officer of the

the Public E-Auction along with the Bid Form which shall be submitted to the Authorised Officer of th the Public E-Auditoria along with the Dir Port in which a hard by the Property of the Property

date

16/10/2023

as on 12/09/2024

enities written in Title Document, Bounded By-North- Plot No. 187, South- Road

Description of property: All That piece and parcel of Residential Plot No.162 admeasuring about 41.28 sq.mt. of together with undivided proportionate share in Road and COP admeasuring about 30.95 Sq.mt. total admeasuring about 72.23 sq.mt. B Type of Madhuvan Residency constructed on land bearing revenue survey No. 115 and 114 Paikee and its block No. 81 according to village form no. 7 and 12 total admeasuring about 30756 sq.mt. of Karell Sub District Olpad District Surat, Gujarat-394310. With

23/05/2023 Rs. 10,71,348/-as on 12/09/2024

vescription of property: All the piece and parcel of the immovable property Bearing Plot No. 212 (As Per K. J. P. Block No. 109/212) admeasuring 42,73 sq. mts., Along with 25,72 sq. mts. Along with undivided share in the land of Road & C. O., in "Aradhana Ambey Valley", Situate at Revenue Survey No. 52/2, Block No. 109 Totally Admeasuring He. Aare 2-93-40 sq. mts. i.e. 29340 sq. mts., of Moje Village Mota, Taluka Bardoli, District- Surat, Gujarat-394345, With common amenities written in Title Document. Property Bounded By- North- Plot No. 211, South- Plot No. 213, East- Society Road, West- Block

The E-auction will take place through portal https://sarfaesi.auctiontiger.net on 30-Sep-202 (E-Auction Date) After 2.00 PM with limited extension of 10 minutes each.

The Intending Purchasers / Bidders are required to deposit EMD amount either through RTGS / NEFT or by way of Demand Draft/RTGS/NEFT favouring the "HERO HOUSING FINANCE LTD." The EMD amount will be return to the unsuccessful bidders after conclusion of the E-

1) E-Auction is being held on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there s Basis" & "Without recourse Basis" and will be conducted "online". (2) B id in cremen amount shall be Rs.15,000. (Rupees Fifteen Thousand Only). (3) The E-Auction will be conducted through M/s E-Procurement Technologies Ltd. (Helpline No(s): 07961200576/544

conducted through M/s E-Procurement Technologies Ltd. (Helpline No(s): 07961200576/ 544/ 594/ 594/ 591/ 583/ 589, 6351896643 and E-mail on support@auctiontiger.net) at their web portal https://sarfaesi.auctiontiger.net. (4) There is no encumbrance on the property which is in the knowledge of Secured Creditors. However, the intending bidders should make their own independent enquires regarding the encumbrances, title of property put on auction and claims/ rights/ dues/ affecting the property, prior to submittling their bids. In this regard, the E-Auction advertisement does not constitute and will not be deemed to constitute ant commitment or any representation of Hero Housing Finance Limited. (5)The Authorized Officer / Secured Creditor shall not be responsible in any way for any third party claims (rights/ due. The sele shall be sublet.)

responsible in any way for any third party claims/ rights/ dues. The sale shall be subject to rules/ conditions/ prescribed under the Securitization and Reconstruction of Financial Assets

and Enforcement of Security Interest Act, 2002. The other terms and conditions of the E-Auction are published in the following website: www.herohousingfinance.com (6) For property details and visit to property contact to Mr. Hari Rajawat hari.rajawat@herohfl.com/9828677772 and Shekhar Singh/ 9711522275.

shekhar.singh@herohfl.com. (7) The prospective bidders can inspect the property of 23-Sep-2024 between 11.00 A.M and 2.00 P.M with prior appointment.

15 DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOF

The above mentioned Borrower/Mortgagor/Guarantors are hereby noticed to pay the sum a mentioned in Demand Notice under section 13(2) with as on date interest and expenses before th

date of Auction failing which the property shall be auctioned and balance dues, if any, will b

For detailed terms and conditions of the sale, please refer to the link provided in

https://uat.herohomefinance.in/hero_housing/other-notice
on Hero Housing Finance Limited (Secured Creditor's) website i.e www.herohousingfinance.com

FOR HERO HOUSING FINANCE LIMITED

Mr. Kushal Dinesh Daglia, Mob-8866346588 Email: assetdisposal@herohfl.com

AUTHORISED OFFICER

Date of Demand Type of Reserve Earnest

onstructive

Physical)

(Physical)

(Physical)

Rs. 6,10,000/-

Rs. 5,20,000/-

Rs. 61,000/-

Name of the Borrower(s)/ Co-Borrower(s)/

Legal Heir/Legal Rep

Upendra Sethi. Pinki

Sethi W/o Upendra

Manoj Santosh Mahale, Kavita Manoj Mahale

TERMS AND CONDITIONS OF THE E-AUCTION:

East-Plot No. 161, West-Plot No. 163

Terms and condition:

DATE : 14-09-2024

PLACE: SURAT

HHFSURHOU

PUBLIC NOTICE (E - AUCTION) FOR SALE OF IMMOVABLE PR



Corporate Office: No. 167-169, 2nd Floor, Anna Salai, Saidapet, Chennai-600015 Branch Office: 3rd, Floor, IFFCO Bhavan, B/h. Maruti Complex, B/h. Pintoo Garment, Nr. Shivranjani Cross Road, Satellite, Ahmedabad-380015. Saurabhkumar Napit Mo.7874828789, Vikas Savariya Mo. 7984982904, Bunty Ramrakhiyani Mo. 9029004701 Hitesh Kumar Patel Mo.7048336601, Sushil Chaudhary Mo. 8118818160, Nitin Samudre M. 8128310678, Shivam Mishra M. 9033015277 Rajesh Dangar M. 7777900058,

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

Notice is hereby given that the following borrower/s who have availed loan from Hinduja Housing Finance Limited (HHFL) have failed to pay Equated monthly installment (EMIs) of their loan to HHFL and that their loan account has been classified as Non-performing Asset as per the guidelines issued by Reserve Bank of India / National Housing Bank. The borrower/s have provided security of the immovable properties to HHFL as on date are also indicated here below. The borrower(s) as well as the public in general are hereby informed that the undersigned being the Authorized Officer of HHFL the secured creditor has initiated action against the following borrower(s) under the provision of the SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 (the SARFAESI Act). If the following borrower(s) fail to repay the outstanding dues indicated against their names within 60 (Sixty) days of this notice, the undersigned will exercise any one or more of the powers conferred on the Secured Creditor under sub-section (4) of section 13 of the SARFAESI Act, including power to take possession of the properties and sell the same. The public in general is advised not to deal with properties described here below:

Name of Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date & Amount & Loan Account No
BORROWER Mr. ASHVIN BHAI BHESANIYA CO-BORROWER Mrs. BHAVIKABEN BHESANIYA	Dt. 13-07-2024 & Rs. 17,09,957/- & Ac. No. GJ/SRT/BRDL/A00000054 & CO/CPC/CPOF/A000002492

SCHEDULE OF THE PROPERTY All parts and parcels of non-agriculture immovable Residential Plot No. 27 (As Per K.J.P. Block No. 73/27 & Re-survey / Promulgation New Block No. 3796 admeasuring 83.23 sq. yard. i.e. 69.59 sq. mts., Along with 47.50 sq.mts. undivided share in the land of Road & C.O.P., in "Yamuna Residency", Situate at Block No. 76, 79, 80, 81 Paiki New Block No. 79 admeasuring He. 1-14 Are 16 sq. mts. i.e. 11416 sq. mts., of Moje Village Velanja, Ta: Kamrej, Dist: Surat To be Purchase by Ashwinbhai Chakubhai Bhesaniya with boundaries as under: East Soc Boundaries, West

Soc Internal Road, North Soc Boundaries and South Plot No 26

	BORROWER	Dt. 13-07-2024 &
	Mr. HARENDRABHAI	Rs. 7,70,123/- &
4	MAKVANA	A/c. No.
	CO-BORROWERMr.	GJ/ANK/VGRA/A000000022
	VAISHALIBEN	GJ/ANN/VGRA/A000000022
	MAKVANA	

All parts and parcels of non-agriculture immovable Property Bearing R.s.No-129/1/1 to 129/1/70 Paikee Sai Shraddha Residency Part-1 Paikee Plot No- 34 Ad area 44.65 sq.mt, COP 30.05 sq.mt +USL 74.70 sq.mt (As per Village\ Form No.7/12 plot No. 129/1/34) Situated at limit of Kharach,

Ta- Hansot, District: -Bharuch will Belong to 1)Mr. Harendrabhai Chhanabhai Makwana 2)Mrs. Vaisahliber Harendrabhai Makwana with boundaries as under: EAST: -Adjoining society, WEST: -Adjoining society Road, NORTH:-Adjoining Plot No-33 and SOUTH:-Adjoining Plot No-35

CO-BORROWER

Mr NIWASH RAM

Mr. NOOR HASAN ANSARI

BORROWER

Mr. RAM DAUR

Mr. PAYAL DOBARIYA

Dt. 16-07-2024 & ·Rs.5,45,929/- & A/C No. GJ/SRT/ADJN/A00000069

All that peace and parcel of immovable Residential Super built up area 610 Sq.Ft. and Built up area

37.41 sq. meter and along with undivided share in land, Revenue Survey No. 104/1+42+3,103/4,121/ 1,151/1,119/9,165/1,165/2,155,57/1,And 158/1 Block No.189/A , Sayan village of Olpad Taluka in the Registration District of Surat-394130, Currently Owned by and Possessed by Mr. Jigneshkumar Patel with boundaries as under; East Adj Flat No A/1-201,West Adj Road,North Building A-2Vibhag – 2 (Township – 2) and South Passage and Adj Flat No A-1/203

BORROWER Dt. 10-07-2024 & Mr. MAHENDRABHAI Rs. 5,95,254/- & DOBARIYA A/C No.

All that peace and parcel of immovable Residential First Floor Flat No. 103, "Building no:I-2", in the Scheme Known as "DHARMANANDAN TOWNSHIP VIBHAG - 1" at admeasuring about Super built up GJ/SRT/ADJN/A000000094 area 54.35 Sq.Mtrs. and Built up area 35.88 sq meter and along with undivided share in land. Revenue Survey No.114/1+2+3.103/4.121/1.151/1 AND

Residential Flat No. 403 on the 4th floor admeasuring

Residential Flat No. 212 on the 2nd Floor

immovable Residential 4th Floor Flat No. 405

19/9, Block No.189/B , Sayan village of Olpad Taluka in the Registration District of Surat-394130 Currently Owned by and Possessed by Mr. Mahendrabhai Gokalbhai Dobariya with boundaries as under;East Adj Flate Number 104,West Road,North Road and South Passage and Adj Flat Number 102 BORROWER All that piece and parcels of land bearing as per Dt. 10-07-2024 & sanction plan Plot no. 137 according to the K.J.F Mr. MANOHAR RAM Rs. 9,18,815/- &

5	Mr. MANOHAR RAM CO-BORROWER Mr. RANJEETA RAM MANOHAR	A/C No. GJ-SRT-KDRA-A000000069	admeasuring about 40.15 sq.mt and on site Plot no. 137 on site admeasuring 40.13 sq.mt. together with undivided proportionate share in Road and C.0.P. admeasuring about 22.11 sq.mt. of	
G	Gokuldham Villa organized on land bearing revenue survey no. 272 paikee and its Block no. 200/A			

Pe 7 05 722/- 8

Dt. 16-07-2024 &

Rs. 7,98,402/- &

Dt. 10-07-2024 &

2 paikee and its Block no. 200/A admeasuring about 24615 sq.mt. of village Tatithaiya Sub District Palsana District Surat. Boundaries: EAST : Adjoining Society Road WEST : Adjoining Plot no. 120 NORTH: Adjoining Plot no. 138 SOUTH Adjoining Plot no. 136 **BORROWER** All parts and parcels of non-agriculture immovable Dt. 16-07-2024 &

CO-BORROWER Mrs. RAJKUMARI DEVI	GJ/SRT/ADJN/A000000017	29.55 sq. mts. Built Up Area, Along with 6.60 sq. mts. undivided Share in the land of "Rudra Residency, Building No. B of Shivdhara Residency Part-2", Situate
		building No. B of Sillvuriara Residency Fart-2, Situate
Revenue Survey No. 72	Block No. 94 admeasuring	12367 sq. mts. Paiki Plot No. 139 of Moie Village, Johna

12367 sq. mts. Paiki Plot No. 139 of Moie Village Jolwa Ta: Palsana, Dist: Surat, To be Purchase by (1) Rajkumaridevi & (2) Niwas Ram with boundaries as nder : East Flat No 404, West Society Road, North Plot No 138 and South Flat No 402 All parts and parcels of non-agriculture immovable BORROWER

admeasuring 551.04 sq. feet Super Built up area, CO-BORROWER A/C. No. 355.70 sq. feet i.e. 33.04 sq. mts. Built up area, 8 GJ/SRT/KIMH/A000000032 Mr. MEHSAR JAHAN 296.42 sq. feet i.e. 27.54 sq. mts. Carpet area, Along ANSARI with 7.46 sq. mts. undivided share in land of

'Shivam Complex of Sandhya Industrial Estate", Situate at Block No. 390 admeasuring Acre 4-16 Guntha Akar Rs. 22.37 Paisa Paiki Plot No. 23, 24, 25, 26 & 27 totally admeasuring 594.78 sq. mts., of Moje Village Sayan, Ta: Olpad, Dist: Surat, To be Purchase by (1) Mehsur Jahan Noor Hasan & (2) Noor Hasan Jami Ahmad Ansari with boundaries as under:East Adj Plot No 28 and 32,West Passage,North Adj Plot No 22 anc South Flat No 213

Rs.7.93,212/- & Building No. A in the scheme Known as Prince 8 CO-BORROWER A/C No. Residency, of Shivam Residency on admeasuring GJ/SRT/SURA/A000000216 Super Built up area 60.41 sq. mts., and Built up area Mr. MANJU DEVI

30.20 sq. mts., Along with undivided 9.06 sq. mts. Share in the land of. Situate at Plot No. 151 to 155 Revenue Survey No. 102/1, 102/2, Block No. 104 & 105 Paiki, B/h. Muslim Kabrastan, Near Magan Wadi, Kadodara Bardoli Road, of Moje Village Kadodara, Ta: Palsana, Dist: Surat. -394327, Currently Owned by and Possessed by (1) Mrs. Manjudevi Daur Ram & (2) Mr. Dabar Far Ram with boundaries as under East Open Plot No 103, West Road, North Open Plot No 150 and South Open Plot No 156

9	BORROWER Mr. RAMNIRJAN GAUD CO-BORROWER Mr. SHYAMSUNDAR GAUD CO-BORROWER Mrs. SEEMA GOUND	Rs.6,80,191/- & A/C No. GJ/SRT/HZRA/A000000059	All parts Resident 638 sq. f 32.89 sq share in Resident Revenue
---	---	--	---

and parcels of non-agriculture immovable tial Flat No. 107 on the 1st floor admeasuring feet Super Built up area, & 354 sq. feet i.e q. mts. Built up area, Along with undivided n the land of Road & C.O.P., in "Shivalay ncy of Shiv Residency Part-2", Situate a Revenue Survey No. 364, 365, Block No. 314/C/1/ Paiki Plot No. 148, 149, 150, 151, 152, 153, 154, of Moje Village Tatithaiya, Tal. Palsana, Dist. Surat, To be

BORROWER Mr. RAMASARE GAUD All parts and parcels of non-agriculture immovable Dt. 10-07-2024 & Residential Flat No. 102 on the 1st floor admeasuring Rs.6,91,966/- & 0 CO-BORROWER 634 sq.feet Super Built up area, & 352 sq. feet ie. A/C No. Mrs. ANARA GAUD

32.71 sq. mts. Built up area, Along with undivided GJ/SRT/HZRA/A000000058 share in the land of Road & C.O.P., in "Shivalay Residency of Shiv Residency Part-2", Situate at Revenue Survey No. 364, 365, Block No. 314/C/1/1 Paiki Plot No. 148, 149, 150, 151, 152, 153, 154, of Moje Village Tatithaiya, Tal. Palsana, Dist. Surat, Currently Owned By And Possessed By (1) Mrs. Anara Ram Aashare And (2) Mr. Ram Aashare Sarajuprashad Gaud with boundaries as under; East Adjoined, Buildings West Adjoined Passage, North Staircase and South Flat No 402

Dt. 13-07-2024 & All parts and parcels of non-agriculture immovable Residential Plot No. 18 admeasuring 40.15 sq. mts. BORROWER Rs. 6,68,458/- & Mrs. REKHA PATEL A/C No. i.e. 48 sq. yard, (As Per K.J.P Block No. 405/18), Along CO-BORROWER GJ/SRT/PLSN/A000000081 with 23.06 sq. mits. undivided share in the land of Road Mr. RAHUL KUMAR PATEL & CO/CPC/CPOF/A000002551 & C.0.P. in "Raghunath Villa", Situate at Revenue Survey No. 419, Block No. 405 admeasuring He. Are. 3 - 79-39 sq. mts., of Moje Village Baleshwar, Ta: Palsana, Dist:

Surat, Currently Owned By And Possessed By (1) Mrs. Rekha Rahulkumar Patel with boundaries as under; East Society Internal Road, West Plot No 46, North Plot 17 South Plot No 19 All That Peace And Parcel Immovable Property Bearing.Plot No.27, Swarg Week and Home, Om Hari Om Park, Type-A, R.S.no. 48, Block No.: 80,

Mr. SHANTANU 2 YADAV CO-BORROWER Mr. VANDANA GJ YADAV	Dt. 16-07-2024 & Rs. 11,05,509/- & A/C No. J/SRT/SURA/A000000299
---	---

Moje: Kareli, Sub. Dist.: Palsana, Dist: Surat. 394310, Kareli, Urban, Surat, Gujrat, India. 394310, Currently Owned By And Possessed By M/s. (To Be Purchase By (1) Mr. SHANTANU PANCHAM RAM YADAV & (2) Mrs. VANDANA SHANTANU YADAV) with is bounded as under; EAST: ROAD, WEST: PLOT NO. 44, NORTH: ROAD, SOUTH: PLOT NO. 26, All parts and parcels of non-agriculture immovable

BORROWER Dt. 16-07-2024 & Mr. SURESH LAXAMAN Residential Flat No. 104 on the 1st Floor admeasuring Rs. 7,59,495/- & 13 SONAR 345.20 sq. feet i.e. 32.08 sq. mts. Built up area, Along A/C No. CO-BORROWER CO-BORROWER
Mr. SARASWATI SONAR
GJ/SRT/PLSN/A000000095 with undivided share in the land of "Amar Palace" Situate at Revenue Survey No. 442 + 443, Old Block

Rs.8.93.745/- &

A/c. No.

A/C No.

GJ/VPI/VAPI/A000000247

Fifth Floor Flat No. 202, Building no: A-1, in the Scheme Known as "DHARMANANDAN TOWNSHIP VIBHAG - 2" admeasuring about Moje Village Umbhel, Ta: Kamrej, Dist: Surat, To be Purchase by (1) Saraswati Suresh Sonar & Surat Will by Scheme Co. 2. (2) Sureshlaxman Sonar with boundaries as under: East Open Land And Flat No 105, West Open Land And roperty,North Flat No 107 and South passage BORROWER All parts and parcels of non-agriculture immovable

Dt. 16-07-2024 & Mr. UMESH RAUAT Rs. 7,20,600/- & Mrs. RANJU DEVI RAUAT A/C No. GJ/SRT/PLSN/A00000064

Residential Flat No. 403 on the 4th floor admeasuring 578 sq. fts. i.e. 53.71 sq. mts. Super Built Up Area, 8 317.96 sq. fts. i.e. 29.55 sq. mts. Built Up Area, along with undivided share in the land of "Sai Residency o Suchi Enclave", Situate at Block No. 113/Paiki 1 & 113/Paiki 2 totally admeasuring 21686 sq. mts., Paiki Plot No. 3 admeasuring 546.71 sq. yard. i.e. 457.12 sq. mts., of

Residential House no plot no. A/30 of New Survey No.

306 (old Survey no. 138/paikee) admeasuring land

Moje Village Bagumara, Ta: Palsana, Dist: Surat, To be Purchase by Umesh Nandlal Rauat with boundaries as under: East Road, West Adj Flat No 402, North Plot No 4 and South Adj Flat No 404 **BORROWER** All parts and parcels of non-agriculture immovable Dt. 23-08-2024 &

	MR. RAJESHRI PATIL	& CO/CPC/CPOF/A00000025
ociety, Mouje-Vijalpore, Tal S No 140 Property South		
	BORROWER MR. HASAN SAHA	Dt. 16-07-2024 & Rs.8,83,551/- &

MR. DEVIDAS PATIL

CO-BORROWER

CO-BORROWER

MRS. REHANABIBI SHAH

R.S.I

area is 41.96 sq.mt. with construction of 75.04 sq.mt (GE+FF) with all other present and future construction having "Property no. 1119/8 as per tax bill, in Sahyog n-396445 With Boudaries East Road North Plot No 29 West ALL THAT PIECE AND PARCEL of the immovable

property being Flat No 102., 102 admeasuring 602

Square Feets lying and located on the First Floor of the

building known as "PANCHRATNA CO. OP. HSG. SOC

LTD." Constructed on N.A. land bearing Survey No

CO-BORROWER 932+933+938+939 Paikee admeasuring 12114.50 MR. ASHRAF SHAH Square Meters Paikee Plot No. 31 admeasuring 486.98 Square Meters Situated at Village- Pardi, Taluka- Pardi, District- Valsad, Gujarat State currently owned and possessed by 1) Smitaben Bharatbhai Prajapati. 2) Parita Hemang Prajapati. 3) Priyanka Bharatbhai Prajapati, 4) Doshi Pankita Kushal and 5) Mansi Bharatbhai Prajapati. (to be purchased by Hasan Shah

	o. Karim Shah) And is bo outh By Flat No. 104;	ounded as under:East By	under:East By FaNo.103 West By FlaNoto North By Open Space;				
17	BORROWER Mr. MAHENDRA KUMAR HARI LAL CO-BORROWER Mrs. CHAMELA DEVI HAREE LAL	Dt. 10-07-2024 & Rs.15,31,728/- & A/C No. GJ-ANK-JGDA-A00000062	All part and parcel of Old R.S.No-631,New R.S. No-183,Paikee Alishan City Paikee Plot No-C/414, Ad area 59.34 sq.mt.COP sqm 41.26 sq.mt Total Ad area 100.60 sq.mt Situated at limit of Jitalian Ankleshwar,District:-Bharuch,East Adj Plot No D-415 West Adj Inmternal Road North Adj Plot No C-419 and South Adj Internal Road				
	BORROWER Mr. RAKESH SINGH	Dt. 16-07-2024 & Rs.6.55.810/- &	All that piece and parcels of Non Agricultural Residential 3rd Floor Flat No. 305 admeasuring 571.00				

8 CO-BORROWER Sq. Mtrs. Equivalent to 53.04 Sq. Mtrs super built up A/C No. Mr. REENADEVI area in the building known as "SAI VATIKA" constructed GJ/VPI/VAPI/A00000016 SINGH on the N. A. land Bearing Survey No. 246/Pike admeasuring 21550.00 Sq.mtrs. Pike Plot No. Plot No. Sq. Mtrs. Computerized Sr. No. 22/A,368.23,246/ Pike 1/Pike 12 22/B,163.00 246/Pike 1/Pike 13 Total 531.23 Situated at: Chhiri, Tal: Vapi, Dist: Valsad-396191and possessed by RAKESH KUMAR and REENA DEVI East Open Land, West Passage, North

Flat No Flat No 304 and South Open Land. All parts and parcels of non-agriculture immovable Property Bearing R.S.No-6 Paikee Ganeshnagar

BORROWER	Dt. 16-07-2024 &
Mr. VINAY KUMAR RAY	Rs.9,94,941/- &
CO-BORROWER	A/C No.
Mrs. GRISHMABEN RAY	GJ/ANK/AMOD/A000000001

Society, Plot No-10/A Ad area 112.50 sq.mt, Adjoinig land 29.97 sq.mt,GF & FF Built up arca 55.34 sq.mt Property No- A/10/1 Situated at limit of Maktampur, Ta & District:-Bharuch will Belong to 1)Mrs.Grishmaben Vinaykumar Ray 2)Mr.Vinaykumar Harila Ray with

boundaries as under:EAST:-Remaining Part of Adjoining House No-10/Á WEST:-Adjoining Road NOŔTH:-Remaining Part of Adjoining House No-10/A SOUTH:-Land of Adjoining Serve No-6 If the said borrowers shall fail to make payments to HHFL as aforesaid, HHFL shall proceed against the above secured assets under section 13(4) of the Act and the Applicable Rules, entirely at the risks of the said Borrowers as to the costs and consequences. The said borrowers are prohibited under section 13(13) the act from transferring the aforesaid assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of HHFL. Any person who contravenes or abets

contravention of the provision of the said Act or Rules made there under, shall be liable as per the provision of section 29 with imprisonment and/or penalty as provided under the Act. Place : GUJARAT **Authorized Officer** Date:14-09-2024 For, Hinduja Housing Finance Limited

Purchase by (1) Gaud Seema Shyamsundar (2) Gaud Shyamsundar Ramniranjan & (3) Gaud Ramniranjar Sarajuprasad with boundaries as under: East Flat No 108,West Flat No 106,North Road and South passage And Flat No 104

सोडसता ^{कु} जनसत्ता वडोहरा

૧૫૦ વર્ષ જૂની પ્રથા ૨૦૨૧ માં નાબૂદ કરવામાં આવી હતી



સરકાર બનશે તો 'દરબાર મૃવ' જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ વિધાન સભા ચૂંટણી યોજાવા જઈ વચન' તો જાણીતું છે પણ, સ્થાનિક પક્ષો 'દરબાર મૂવ' સિસ્ટમ (દરબાર સ્થાનાંતરણ પ્રથા)ની પુનઃસ્થાપનાનું વચન પણ આપી રહી છે. ઓમર

ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની રહયો છે શિયાળો શરૂ થાય એટલે રાજધાનીને દિગ્ગજ નેતાઓ જો એમની સરકાર બનશે તો 'દરબાર મૂવ' સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાનું વચન આપી રહ્યા છે

> કરવી પડતી. આ બધા કામમાં પુષ્કળ સમય અને નાણાં ખર્ચાતાં, તોય અગાઉથી ચાલી આવતી હોવાથી આ પ્રથા દાયકાઓ સુધી ચાલુ રહી હતી. 'દરબાર મૂવ'ની પ્રથા ૧૮૭૨માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે રાજ્યમાં ડોગરા શાસક મહારાજા રણબીર સિંહનું રાજ હતું. માન્યતા એવી છે કે

ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજધાની સ્થાનાંતર પાછળ માત્ર હવામાન જ નહીં, રાજકીય કારણો પણ જવાબદાર હતા, એવું માનવામાં આવે છે. ૧૮૭૦ના દાયકામાં વિજયી વાવટા લહેરાવતી રશિયન સેના અફઘા નિ સ્તાન સુધી પહોંચી ગઈ હતી. એ પછી એમનો ડોળો કાશ્મીર ખીણ પર હતો. અંગ્રેજોને ડર લાગ્યો કે રશિયનો કાશ્મીર ખીણ જીતી લેશે તેથી અંગ્રે જો એ રાજ્યની સત્તા મહારાજા પાસેથી લઈ લીધી અને સલામતી માટે રાજધાનીના સ્થાનાંતરણની પ્રથા શરૂ કરી. ૧૮૭૩માં અંગ્રેજોએ રશિયનો સાથે વાટાઘાટો કરીને સમજૂતી કરાર કર્યા. એ પછીના ૩૫ વર્ષ સુધી જમ્મુ-હવામાનને કારણે દરબારને જમ્મુથી કાશ્મી રના મહારાજા માત્ર નામના

રી - ટેન્ડર નોટીસ (જાહેર નિવિદા ૨૦૨૪-૨૫)

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,વડોદરા હસ્તકની પ્રા.શાળાઓમાં સને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં સમિતિની શાળાઓ /કચેરીના નીચેની વિગતે વાર્ષિક ઇજારા અંગેના ટેન્ડરો મંગાવવામાં આવે છે. જે તે ધંધાનો અનુભવ અને રસ ધરાવતી GST નંબર વાળી એજન્સી/સંસ્થા દ્વારા નીચે જણાવેલ વિગતે ભાવ પત્રકો મંગાવવામાં આવે છે. જે અંગેના કોરા ટેન્ડર ફોર્મ ઉપરોકત સરનામેથી કચેરીના કામકાજના દિવસોમાં મેળવી શકાશે. ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ થયા તારીખ થી ટેન્ડર ફી રૂ.૫૦૦/- યુકવ્યેથી <u>તારીખ: ૨૧-૯-૨૦૨૪ બપોરના ૨-૦૦ કલાક સુધીમા</u>ં મેળવી શકાશે. ભરેલા ભાવપત્રકો બંધ કવરમાં અંદાજી રકમના 3% અર્નેસ્ટમની ની રકમ ફોર્મમાં દર્શાવ્યા મુજબનો બેન્કનો ડિમાન્ડ ડ્રાફટ ભરેલા ટેન્ડર ફોર્મ સાથે અલગ થી તારીખ: ૨૧ -૯-૨૦૨૪ ના રોજ બપોરના ૪-૦૦ ક્લાક સુધીમાં સમિતિની કચેરીમાં રૂબરુ પહોંચાડવાના રહેશે. નીચે જણાવેલ તમામ પ્રકારની જરૂરી સાધન સામગ્રી ના ભાવ જી.એસ.ટી. તથા અન્ય ટેક્ષ સિવાય ભાવ ના ભરવાના રહેશે.

અ.નં.	કામની વિગત	200	અંદાજીત રકમ	3% અર્નેસ્ટમની
٩	સમિતિની શાળાઓની માહિતી તથા સમિતિમાં થતા કાર્યક્રમો		3.4,00,000/-	રૂ.૧૫,૦૦૦/-
	તથા સરકારશ્રી દ્રારા આપવામાં આવતી માહિતીઓનો તથા			
	સમિતિના અધ્યક્ષશ્રી અને ઉપાધ્યક્ષશ્રી ના એકાઉન્ટ સોશ્યલ			
	મિડીયા,ફેસબુક,ટવીટર,ઇન્સ્ટાગ્રામ,યુ ટ્યુબ વગેરે ઉપર			
	પ્રચાર પ્રસાર કરવા અંગેની કામગીરી માટે નો વાર્ષિક ઇજારો			
	(A.M.C.) ટેન્ડર ફ્રોમ માં જણાવેલ સ્પેશીફીકેશન મુજ્બ			

આ અંગેની વિગતવાર માહિતિ કચેરીના નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવેલ છે. ટેન્ડરની શરતોને આધિન તેનો સ્વીકાર કરવાનો કે રદ કરવાનો નિર્ણય સમિતિનો રહેશે. જે અંગે કોઇપણ કારણ આપવા કચેરી બંધાયેલી

> સહી/- અવાચ્ય શાસનાધિકારી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,વડોદર1

જિલ્લા ઉધોગ કેન્દ્ર, વડોદરા

ઓગસ્ટ /સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન પુરના કારણે વડોદરા જિલ્લાના વાણિજ્ય, વેપારી અને <mark>સેવાકીય અસરગસ્તોને થ</mark>યેલ નુકશાની માટેની સહાય યોજના

ગુજરાત સરકાર ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવકમાંક:IMD/WRT/e-file/9/2024/2368/CH, સચિવાલય, ગાંધીનગરના તા.૧૧/૦૯/૨૦૨૪ થી વડોદરા જિલ્લાના પ્ અસરગ્રસ્ત વિસ્તારોના નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર, વાણિષ્ય અને સેવાકીય એકમોને આર્થિક સહય તેમજ પુનઃવસન સહય આપવાનું ઠરાવવામાં આવેલ છે.

સદર 6રાવની ક્રમ (૫) મુજબ નીચેના એકમો સહ્યય મેળવવા પાત્ર થાય છે.					
ક્રમ	વર્ગ	પાત્રતા	સહ્ાયની રકમ		
ч	મોટી	દુકાનનું પાકું બાંધકામવાળું સ્થાયી માળખું હોય અને	રૂ. ૨૦ લાખ સુધીની લોન લેનારને ૩ વર્ષ સુધી વ્યાજ સહાય		
	દુકા ન	જેનું છેલ્લા ત્રિમાસિક GST રીટર્ન મુજબ માસિક	૭%ના દરે વધુમાં વધુ કુલ રૂ. ૫ લાખની મર્ચાદામાં		
		ટર્નઓવર રૂ. ૫ લાખથી વધુ હોય			

- આ ફેઠળની સફાય મેળવવા માટે અરજદારે જિલ્લા ઉધોગ કેન્દ્ર,વડોદરા ને નિયત નમુનામાં લોન મેળવ્યાના પુરાવા સાથે અરજી કરવાની રફેશે. અરજીની પહોંચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેળવી લેવાની રહેશે
- બેંક/નાણાકીય સંસ્થા દ્વારા અસરગુસ્ત એકમને પુન:શરૂ કરવા માટે નાણાકીય જરૂરીયાતનું એસેસમેન્ટ કરવામાં આવશે. આવા એસેસમેન્ટના આધારે બેંક/નાણાકીટ
- એકમે પન:વસન થયા બાદ વ્યાજસહાયનો દાવો જે તે બેંકાનાણાકીય સંસ્થાએ જિલ્લા ઉધોગ કેન્દ્રને મોકલવાની રહેશે. જિલ્લા ઉધોગ કેન્દ્ર વ્યાજ સહાયના દાવાની ચકાસણી કરી, મંજૂર થયેલ લોન સામે બેંક /નાણાકીય સંસ્થાએ યુકવેલ લોન વપરાશ અંગેના પ્રમાણપત્ર મુજબના મળવાપાત્ર વ્યાજસહાયની રકમ અરજદાર એકમના લોન એકાઉન્ટમાં ઈ-પેમેન્ટથી યુકવવામાં આવશે.
- અસરગ્રસ્ત એકમોએ એપીએમસી માટેની સहાય યોજના હેઠળ સહાય મેળવી ફશે તો પ્રસ્તુત યોજના હેઠળ સહાયપાત્ર થશે નહી.
- અરજી કરવાની સમય મર્યાદા તારીખ ૩૧/૧૦/૨૦૨૪ સુધીની રહેશે
- નીચેના આધાર/પુરાવા સાથે સામેલ નમુનામાં અરજી કરવાની રહેશે.
- ૧. જી.એસ.ટી. (GST) નોંધણીનું પ્રમાણપત્ર.
- ર. છેલ્લા ત્રણ માસના જી.એસ.ટી રીટર્ન (GSTR 3-B) ની નકલ
- 3. થયેલ નુકશાનના ફોટોગ્રાફસ
- ૪. બેંકનો કેન્સલ ચેક/પાસબુકની નકલ
- આ બાબતે કોઈ પણ પ્રશ્ન ફોય પહેલો માળ, સી-બ્લોક, નર્મદા ભવન, જેલ રોડ, જિલ્લા ઉધોગ કેન્દ્ર વડોદરાની કચેરીનો સંપર્ક કરવો

અરજીપત્રકનો નમુનો મેળવવા QR Code સ્કેન કરવે



સંયુકત ઉદ્યોગ કમીશ્વર અને જનરલ મેનેજર જાલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વડોદરા

(માહિતી/વડો/દુદ્દ૦/૨૪-૨૫)



CIN: L67100MH1995PLC093797

Regd. Office: IIFL House, Sun Infotech Park, Road No. 16V, Plot No.B-23, Thane Industrial Area, Wagle Estate, Thane - 400604 Tel: (91-22) 41035000 • Fax: (91-22) 25806654

સોનાના દાગીનાની લિલામીની જાહેર સૂચના

અત્રે ચોક્કસ રીતે સર્વ સંબંધિત ઋણદાર(રો) અને સામાન્ય રીતે જનતાને માહિતગાર કરવામાં આવે છે કે અમે આઈઆઈએફએલ ફાઈનાન્સ લિમિટેડ (''આઈઆઈએફએલ'') દ્વારા નોંધણીકૃત લિલામીની સૂચનાઓ થકી અને વારંવાર ચાદગીરીઓ થકી માહિતગાર કરવા છતાં જેમણે પોતાની લોન નિયમિત કરી નથી કે બાકી રકમ ચૂકવી નથી તેવા કસૂર કરનારા ગ્રાહકોના સોનાના દાગીના લિલામ કરી રહી છે. નિમ્નલિખિત ખાતાંમાં ગિરવે મુકાયેલા સોનાન દાગીનાની જાહેર લિલામી 17.09.2024 ના રોજ બપોરે 01:30 થી 04:00 વચ્ચે તેમના ઓનલાઈન લિલામી મંચ https://egold.auctiontiger.net થકી **ઈ-પ્રોકચોરમેન્ટ ટેકનોલોજીઝ લિમિટેક** ઓનલાઈન ફાય ધરાશે. સ્થળ અથવા તારીખ (જો કોઈ હોય તો)માં ફેરફાર લિલામી કેન્દ્ર ખાતે પ્રદર્શિત કરાશે. જો કોઈ કારણસર ઈ–લિલામી અહીં ઉદ્વેખિત તારીખે હાથ નહીં ધરી શકાય અથવા લિલામી તે જ દિવસે પૂર્ણ નહીં થાય તો આઈઆઈએફએલ લિલામી મંચ અને/અથવા લિલામી કેન્દ્ર પર તે જ નિયમો અને શરતો સાથે કોઈ પણ ત્યાર પછીની તારીખે આવી લિલામી हાથ ધરવાનો અથવા આગળ વધવાનો અબાધિત અધિકાર ધરાવે છે. લિલામી નહીં કરેલા દાગીના લિલામી મંચ અને/અથવા લિલામી કેન્દ્ર પર વિગતો પ્રદર્શિત કર્યા પછી ત્યાર બાદના કામકાજના દિવસે લિલામી કરાશે. શાખા સ્તરે લિલામી ઈચ્છિત પ્રતિસાદ પ્રાપ્ત નહીં કરી શકે તો તે નિર્દિષ્ટ જિલ્લા કેન્દ્ર ખાતે 28.09.2024 ના રોજ ફરીથી લિલામી કરાશે. જો કોઈ કારણસર જિલા સ્તરે લિલામી અહીં ઉદ્વેખિત તારીખના રોજ હાથ નહીં ધરી શકાય અથવા લિલામી તે જ દિવસે પૂર્ણ નહીં થાય તો આઈઆઈએફએલ તે જ નિયમો અને શરતો સાથે કોઈ પણ ત્યાર પછીની તારીખે જિલા સ્તરે લિલામી હાથ ધરવાનો અથવા આગળ વધવાને અબાધિત અધિકાર ધરાવે છે. જો ગ્રાહક મૃત્યુ પામે તો લિલામી સંબંધી બધી શરતો નોમિની /કાનૂની વારસદારને લાગુ થશે.

જિલા કેન્દ્રઃ છોટા ઉદેપુર જીએલ - સિટી સર્વે નંબર 2255, પહેલો માળ, માણેક ચોક, પંજાબ નેશનલ બેંકની બાજુમાં, સામે.કુસુમ સાગર લેક પેલેસ રોક, છોટા ઉદેપુર, 391165

શાખાનું નામઃ બોકેલી જીએલ, તાલુકો - સંખેડા

ગોલ્ક લોન અકાઉન્ટ નં.: GL30819777, GL30805464, GL28854160, GL30816854, GL30820282, GL28857353, GL30786268, GL29853080, GL30796675, GL30326459, GL30406658, GL30588061, GL29869444, GL30777885, GL30489022, GL30748585, GL30760150, GL28772425, GL28787805, GL28785237, GL30757392, GL30752820, GL25893288, GL22142269, GL22385702, GL28746633, GL28712259, GL30711886, GL30698917, GL30701583, GL30713193, GL30713155, GL30688609, GL22121377, GL27947346, GL28664025, GL28661721, GL33613325, GL28635860, GL22082843. GL29859235. GL30171385. GL24172256. GL29979473. GL24383443. GL29927513. GL22050809. GL29915687, GL22046464, GL22033207, GL32214312, GL22033198, GL28126352, GL23488052, GL31186589, GL30541082, GL30537780, GL30367438, GL30376725, GL28523984, GL28513684, GL32243586, GL23651936, GL28450250, GL28455295, GL28393216, GL30247743, GL30253463, GL28206674, GL25026836, GL31924275, GL30076770, GL30061363, GL30033205, GL29915453, GL29927483, GL29981718, GL29926813, GL29925001 GL29912509, GL29920783, GL29897822, GL29893408, GL27611655, GL27603531, GL29385782, GL29401998

શાખાનું નામઃ છોટા ઉદેપુર-જીએલ, તાલુકો - છોટા ઉદેપુર

ગોલ્ડ લોન અકાઉન્ટ નં.ઃ GL30812441, GL30822692, GL30795408, GL30787230, GL28778829, GL30749456, GL30760404, GL28718575, GL28675654, GL30682883, GL30666189, GL28485851, GL28490273, GL28500599, GL28422216, GL30338463, GL30342656, GL29956245, GL29951947, GL29706860, GL29700541, GL29379741, GL29359973, GL28518432, GL27896622, GL27887467

શાખાનં નામ: નાસવાડી-નાસવાડી જાએલ. તાલકો - નાસવાડી

ച്ടെ രിച്ച ഷടര്യം പ്.: GL28835938, GL29533810, GL28823709, GL30789019, GL30788756, GL30751527, GL29563224, GL29671091, GL28841692, GL30796153, GL30760990, GL30759907, GL30747707, GL30710223, GL30695208, GL28654953. GL30594905. GL30583536. GL29973944. GL27785490. GL22007352. GL30503022. GL30512502. GL26534896, GL27841463, GL25765333, GL30382202, GL26181433, GL26724899, GL30296989, GL30317207, GL30263944, GL30204664, GL30063991, GL30068509, GL28423563, GL22425564, GL26380125, GL29532431, GL29544921, GL29442455, GL27146467, GL26182475, GL29286218, GL26284863, GL26304933

શાખાનું નામઃ પાવી જેતપુર જીએલ, તાલુકો - પાવી જેતપુર

ગોલ્ડ લોન અકાઉન્ટ નં.ઃ GL30698791, GL30711867, GL28749255, GL30714927, GL30692428, GL30713062, GL30709920, GL30707769, GL30649566, GL30711278, GL30688359, GL30688590, GL30713191, GL28680885, GL28647337, GL30613127, GL30627504, GL30622703, GL30626363, GL30623687, GL30624401, GL30416318, GL28608214, GL29940111, GL28595373, GL32303125, GL29759593, GL31130923, GL30596525, GL30573107, GL28571701, GL30552145, GL30554602, GL29516282, GL28546118, GL34336271, GL28524291, GL28514851, GL28514087, GL28524096. GL30400412. GL30390376. GL28301883. GL28293244. GL28197249. GL28212527. GL30233909. GL30221677, GL28158907, GL30210014, GL30201300, GL29817652, GL29802209, GL30172337, GL28117451, GL30187956, GL28094362, GL30132569, GL30133575, GL27967855, GL27990321, GL29285656, GL31127424, GL21662868, GL29857582, GL29870414, GL29738608, GL29698300, GL29706344, GL33389703, GL22064998, GL27420042, GL27398717, GL29555163, GL28945319, GL29509486, GL27233728, GL27207385, GL27217910, GL32707827, GL29197436, GL29200198

શાખાનું નામઃ સંખેડા-સંખેડા જીએલ, તાલુકો - સંખેડા

તારીખ: 14.09.2024

સ્થળઃ છોટા ઉદેપુર

ગોલ્ડ લોન અકાઉન્ટ નં.ઃ GL30783337, GL30799606, GL28772348, GL28787781, GL30758623, GL30744266, GL30754623, GL30758383, GL30690683, GL30643051, GL30714148, GL30711070, GL30699567, GL30712169, GL26073796, GL22105449, GL28611241, GL28604949, GL23637917, GL28571773, GL32354377, GL30462720, GL30482220, GL26778843, GL22137448, GL30300168, GL30318675, GL28231376, GL28244013, GL30271273, GL30107931, GL30089619, GL30071577, GL29845051, GL29833165

ઈ–લિલામી 'જેમ છે જ્યાં છે,' 'જે છે તે' અને 'ત્યાં જે છે તે' ધોરણે ફાથ ધરાશે અને આઈઆઈએફએલ કથિત સોનાના દાગીનાની ગુણવત્તા, શુદ્ધતા કેરેટેજ, વજન અથવા મુલ્યાંકન વિશે કોઈ આલેખન કે બાંયધરી આપતી નથી. ઈ–લિલામી પ્રક્રિયા અને આવી ઈ–લિલામ અંતર્ગત વેચાણ (જો કોઈ હોચ તો) આઈઆઈએફએલ તેની એકમેવ મરજીથી લાદવાનું અનુકૂળ માની શકે તે નિયમો અને શરતોને આધીન રહેશે. આઈઆઈએફએલ, તેની એકમેવ મરજીથી લિલામીની ચાદીમાંથી કોઈ પણ બાબત અને કોઈ પણ કાર્યવાદી, પૂર્વસૂચના આપ્યા વિના અને તે માટે કોઈ પણ કારણ આપ્યા વિના મોકૂફ અથવા દૂર કરી શકે અને તે માટે કોઈ પણ કારણ આપ્યા વિના કોઈ પણ અથવા સર્વ બિડ્સ અથવા ઓફરો નકારી શકે છે. કસૂર કરનારા ગિરવે મૂકેલા દાગીનાની વિગતો તેમ જ અન્ય વિગતો સંબંધિત શાખા ખાતે પ્રદર્શિત કરાઈ છે. ડિફોલ્ટર ઋણદાર(રો) પાસે આ સૂચનાની પ્રસિદ્ધિ પછી પણ તે તારીખ સુધી વ્યાજ અને સર્વ લાગુ શુલ્ક સિંદત સંપૂર્ણ લેણાં પુનઃચુકવણી કરવાનો અને તેમનું લોન અકાઉન્ટ બંધ અથવા નિયમસર કરવાનો વિકલ્પ છે, પરંતુ કોઈ પણ કિસ્સામાં લિલામીની તારીખ સુધી જ આ વિકલ્પ અજમાવી શકશે, જેમાં નિષ્ફળ જવા પર ગિરવે મંકેલા સોનાના દાગીના લિલામી કરવામાં આવશે અને બાકી લેણાં (જો કોઈ હોય તો) વ્યાજ અને ખર્ચ સાથે વસલ કરાશે. જોકે કસર કરેલી લોન આ પ્રસિદ્ધિની તારીખના રોજ અથવા પછી બંધ કે નિયમિત કરાય તો પ્રમાણસર પ્રકાશન શુલ્ક ભોગવવાનો રહેશે. ઝેણદારને જો કોઈ હોય તો, વધારાની લિલામીની પ્રાપ્તિઓના રિફંડ માટે તેમની છેલામાં છેલી બેન્ક અકાઉન્ટની વિગતો સુપરત /અપડેટ કરવાની વિનંતી છે.

વિગતવાર માહિતી, નિયમો અને શરતો માટે આઈઆઈએફએલ ફાઈનાન્સ લિમિટેડના સંબંધિત શાખા કાર્યાલયનો સંપર્ક કરો.



અધિકૃત સહીકર્તા આઈઆઈએફએલ ફાઈનાન્સ લિમિટેડ

રહી છે. રાજ્યની ૯૦ વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો અનેક પ્રકારના વચનો આપી રહ્યા છે. 'કલમ ૩૭૦ની પુનઃસ્થાપનાનું

સંજોલી મસ્જિદ વિવાદ

પૂર્વ મેયર સહિત ૪૩

લોકો સામે એકઆઇઆર

શિમલા,તા.૧૩ હિમા ચ લ પ્રદેશની રાજધાની

શિમલામાં સંજૌલી મસ્જિદ વિવાદ

કેસમાં, કલમ ૧૬૩ લાગુ હોવા છતાં,

હજારો લોકો એકઠા થયા અને પ્રદર્શન

કર્યા પછી પોલીસે ચાર FIR નોંધી છે.

પોલીસે આ કેસમાં શિમલાના પર્વ મેયર

એમસી સહિત ૪૩ લોકોને આરોપી

કોંડલ, કમલે નામ સામેલ છે.

નંબરે તુરંત જાણ કરવી.

તા. ૧૨-૯-૨૦૨૪

મોબાઈલ નંબર : 9824198256

यूको बैक

(भारत सरकार का उपक्रम)

સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાનું વચન આપવા લાગ્યા છે. ચાલો જાણીએ કે અચાનક જ ચૂંટણીનો મુદ્દો બની ગયેલી 'દરબાર મૂવ' સિસ્ટમ શું છે અને એને ચૂંટણી સાથે શું લાગેવળગે છે?જમ્મુ-કાશ્મીરમાં 'દરબાર મૂવ' પ્રથા ૧૫૦ વર્ષથી વધુ જૂની છે. તે ૨૦૨૧ માં નાબૂદ કરવામાં આવી હતી. આ પ્રથા અંતર્ગત દર છ મહિને જમ્મુ-કાશ્મીરની રાજધાની બદલવાનું ચલણ હતું. શિયાળામાં રાજધાની જમ્મુ રહેતી, અબ્દુલ્લા અને અલ્તાફ બુખારી જેવા જ્યારે ઉનાળામાં રાજધાની શ્રીનગર રાજ્યના દિગ્ગજ નેતાઓ જો એમની રહેતી. ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં

શ્રીનગરથી જમ્મુ ખસેડવામાં આવતી અને એ પ્રિલના છેલ્લા સપ્તાહમાં ઉનાળાે બેસે ત્યારે રાજધાનીને જમ્મુથી શ્રીનગર ખસેડવામાં આવતી. રાજધાની બદલવાની આ પ્રથા 'દરબાર મૂવ' કહેવાતી.દર છ મહિને રાજધાની બદલાતાં તમામ મહત્ત્વપૂર્ણ સરકારી કચેરીઓ અને સચિવાલયોને જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મું ખસેડવામાં આવતી. સ્થળાંતર દરમિયાન ફાઇલો અને માલસામાનને ટ્રકોમાં ભરીને જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ લાવવામાં આવતાં. બંને શહેરો વચ્ચે ૩૦૦ કિલોમીટરનું અંતર કાપવું પડતું. નવા સ્થળે ૧૦

કર્મચારીઓના રહેઠાણની વ્યવસ્થા

હજારથી વધુ

શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ રાજા રહ્યા હતા. જૂન ૨૦૨૦માં ગલવાન ખીણમાં થચેલી અથકામણોએ ભારત-ચીન સંબંધોને અસર કરી છે

જમ્મુ-કાશ્મીરમાં "દરબાર મૂવ" પ્રથા

ચીન સાથે સૈનિકો પાછા ખેંચવા સંબંધિત ७૫ ટકા મુદ્દાઓ ઉકેલાયા

બનાવ્યા છે. તેમના પર ગેરકાયદેસર રીતે પ્રદર્શન કરવા, પોલીસ કર્મચારીઓ નવી દિલ્હી, તા.૧૩ પર હુમલો કરવા અને તેમને ઈજા બેઈજિંગ સાથેના સંબંધો પર ભારતીય વિદેશ મંત્રી જયશંકરનું મોટું પહો ચાડવા અને ચોક્કસ સમુદાય વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો ઑરોપ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે છે.પોલીસે સંજૌલી માર્કેટમાં પ્રદર્શન ચીન સરહદ પરથી સૈનિકો હટાવવાની દરમિ યા ન પ્રદર્શનકારીઓ દ્વારા સાથે ૭૫ ટકા વિવાદો ઉકેલાઈ ગયા કરવામાં આવેલા પથ્થરમારાનો વીડિયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર કર્યો છે. તેના આધારે પોલીસ સરહદ પર હિંસો પછી એવું ન કહી પથ્થરમારો કરનારાઓની ઓળખ કરી શકાય કે અન્ય સંબંધો તેનાથી અસ્પૃશ્ય રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો સાથે સરહદી વાટાઘાટોને લઈને મોટું કર્યો હતો. આ પછી પોલીસે કાયદો નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે બેઇજિંગ સાથેની લગભગ ૭૫ ટકા અને વ્યવસ્થા જાળવવા બળપ્રયોગ કર્યો હતો. શિમલાના એસપી સંજીવ સમસ્યાઓ, ખાસ કરીને છૂટાછેડા કુમાર ગાંધીએ કહ્યું કે ગેરકાયદેસર 🛮 સાથે સંબંધિત, ઉકેલાઈ ગઈ છે, જો રીતે પ્રદર્શન કરનારા અને પોલીસ કે, બંને દેશોએ હજુ પણ કેટલાક કામ પર હુમલો કરનારાઓ વિરુદ્ધ કેસ કરવાનું બાકી છે. જયશંકરે એ પણ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની વાત કરી કે કેવી રીતે ભારત અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ચીન વચ્ચે ભૂતકાળમાં ક્યારેય સરળ સંબંધો નહોતા.વિદેશ મંત્રીએ કહ્યું કે આવી સ્થિતિમાં આ કેસમાં વધુ લોકોના નામ સામેલ થઈ શકે છે.પૂર્વ મેયર સત્ય "અમારા ભૂતકાળમાં સરળ સંબંધો નહોતા. ૨૦૨૦માં જે થયું તે અનેક

શેર સર્ટીફીકેટ ખોવાચેલ<u> છે.</u>

આથી અમો નીચે સહી કરનાર ભાવનાબેન સંજયભાઈ વાઘરી રહે.ક્રિષ્ણાનગર

ઝ્પડપટ્ટી વાઘોડીયા રોડ વડોદરાનાઓ ગોપાલનગર કો. ઓ. હાઉસીંગ સોસાયટી લી.

ાં આવેલ મહાન નં. ૩૧ ના સ્વતંત્ર માલીક છીએ જેનો ૨૧૧-૨૨૨ નંબર દા. ૯૦.૯૪ છે..!

મિલકતના જુના માલિક રાજેશભાઈ ઓચ્છવલાલ બ્રહ્મભટ્ટ ના નામે નામ ફેર કરેલ

અસલ શેર સર્ટીફીકેટ જેનો શેર સર્ટીફીકેટ નંબર ૩૯ પાન નંબર ૫ થી રૂપીચા ૫૦

સર્ટીફીકેટ ગેરવલે થઈ ગયેલ છે. તથા સોસાયટી દ્વારા ફાળવવામાં આવેલ અસલ

એલોટમેન્ટ લેટર અને અસલ પઝેશન લેટર ગેરવલ્લે થઈ ગચેલ છે. અને ધણી

શોધખોળ કરવા છતા મળી આવતું નથી જેથી જે ક્રોઈ વ્યક્તિને અસલ શેર સર્ટીફીકેટ,

અસલ એલોટમેન્ટ લેટર, અસલ પંઝેશન લેટર મળી આવે તો નીચે જણાવેલ મોબાઈલ

જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ,વાસ્મો-નર્મદા

ઓનલાઈન જાહેર નિવિદા નં:-૦૪ સને ૨૦૨૪-૨૦૨૫

ગુજરાત રાજયના માન્ય વિભાગમાં યોગ્ય શ્રેણીમાં રજીસ્ટ્રેશન થયેલ માન્ય ઇજારદારો

<mark>પાસેથી નર્મદા જીલ્લાના</mark> ખતામ ગામની પીવાના પાણીની યોજનાકીય કામગીરી માટે

કુલ અંદાજીત રકમ રૂ.૧૩.૦૩ લાખ સુધીના ઉપરોકત આઇ.ડી નંબરની વિગતે સંબધિત

ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ વતી યુનિટ મેનેજર, જીલ્લા જળ અને સ્વચ્છતા

એકમ,વાસ્મો નર્મદા,ફોન.નં ૦૨૬૪૦-૨૨૧૦૯૦ દ્વારા ઇ-ટેન્ડરીંગથી ભાવો મંગાવવામાં

આવે છે.ટેંડર ફી/બાનાની રકમ તેમજ કામોની વિગતવાર માહીતી તથા અન્ય વિગતો

વેબસાઇટ www.nprocure.com ઉપર જોઇ શકાશે. ટેન્ડર ઓન લાઇન ભરવાની છેલ્લી

તા:૨૭/૦૯/૨૦૨૪,૧૮.૦૦ કલાક સુધીની રહેશે. અને જરૂરી દસ્તાવેજો અસલમાં

તા.30/0૯/૨૦૨૪ ના રોજ ૧૮.૦૦ કલાક સુધીમાં અત્રેની કચેરીમાં

આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ રૂબરૂમાં સાદર કરવાના રહેશે. હવે પછી ટેન્ડરમાં કોઈપણ

સુધારો ઓનલાઈન પ્રસિધ્ધ કરવામાં આવશે. કરારખત,વર્ક ઓર્ડર તેમજ કામના

બીલના યુકવણાની કાર્યવાહી સંબંધિત ગામની ગ્રામ્ય પાણી અને સ્વચ્છતા સમિતિ

ધ્વારા કરવામાં આવશે. કોઈપણ કારણ આપ્યા સિવાય સબંધિત પાણી સમિતિ ટેન્ડર

ટેંડર આઇ.ડી.નં.(૧૦૭૩૦૨)

ભાવનાબેન સંજચભાઈ વાઘરી

વાચ પી. ખારકે (એડવોકેટ & નોટરી

(માહિતી/નર્મદા/૨૫૮/૨૦૨૪-૨૫)

UCO BANK

(A Govt. of India Undertaking)

સંખ્યામાં સૈનિકો મોકલ્યા હતા. અમે જવાબમાં અમારા સૈનિકોને ખસેડચા હતા. ઉપર "મોકલવામાં આવ્યું છે. જિની વા સેન્ટર ફોર સિક્યોરિટી પોલિસી ખાતે રાજદૂત જીન-ડેવિડ લેવિટ સાથેની વાતચીત દરમિયાન વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પૂર્વી લુદાખમાં સરહદ મુદ્દે સૈનિકો પાછા ખેંચવા સંબંધિત મુદ્દાઓ લગભગ ૭૫ ટકા ઉકે લાઈ ગયા છે પરંતુ સરહદ પર વધતા લશ્કરીકરણનો મોટો મુદ્દો રહે છે. તેણે કહ્યું કે અમારે હજુ થોડું

શક્યતાઓ પર વિચાર કરી શકીએ છીએ. આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે." જયશંકરે કહ્યું કે ભૂતકાળમાં ચીન સાથે સરહદ વાટાઘાટોમાં થોડી બંને દેશો વચ્ચે મુશ્કેલ સંબંધો રહ્યા પ્રગતિ થઈ છે."જયશંકરે ગુરુવારે છે. તેણે ૨૦૨૦ વિશે પણ વાત કરી Change of Name જ્યારે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જયશંકરે કહ્યું કે જૂન ૨૦૨૦ માં ગલવાન ખીણમાં થયેલી અથડામણોએ ભારત-ચીન સંબંધોને અસર કરી છે, ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદ પર હિંસા પછી, એવું કહી શકાય નહીં કે બાકીના સંબંધો તેનાથી અસ્પૃશ્ય છે. તેમણે કહ્યું કે ચીન સાથેના આર્થિક કામ કરવાનું બાકી છે.તેમણે વધુમાં સંબંધો "અયોગ્ય અને અસંતુલિત" કહ્યું, ''જો સૈનિકો પાછા ખેંચવા અને રહ્યા છે . વિદેશ મંત્રીએ કહ્યું, ''આ

સમજૂતીઓનું ઉલ્લંઘન હતું, ચીને શાંતિ અને સ્થિરતા વરત આવવાનો (ભારત-ચીન સંબંધો) ખૂબ જ જટિલ વાસ્તવિક નિયંત્રણ રેખા પર મોટી કોઈ ઉકેલ આવે તો અમે અન્ય સંબંધ છે... ઇતિહાસમાં તેમનો ખરાબ સમય પણ રહ્યો છે. બંને સંબંધોને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એક રીતે બંનેને નવજીવન આપે છે.

I. Smt MANJULA DEVI

legally wedded spouse of No. 14346521 EX NK (LATE) TADVI BUDHA BHAI BHAILAL BHAI presently residing at Gopalpura, Dabhoi, /adodara, Gujarat-391110 have Changed my name

from MANJULA DEVI

To MANJULABEN TADVI vide affidavit dated 02-09-2024 Sworn before Soyab N. Kadia Notary at Dabhoi, dist. Vadodara.



Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company Regd. Office: P.O.Narmadanagar - 392015, Dist.: Bharuch (Gujarat), India, CIN: L24110GJ1976PLC002903, Tel: 02642 247001, 247002, E-mail: investor@gnfc.in Website: www.gnfc.in

ADDENDUM TO THE NOTICE OF 48th ANNUAL GENERAL MEETING

This is with reference to the Notice dated August 13, 2024 sent electronically to the members on August 28, 2024, for convening 48th Annual General Meeting (AGM) of Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited ("the Company") on Friday, September 20, 2024 at 03:00 P.M. through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"), to transact the business set out therein. The said notice has been sent in due compliance with all the applicable provisions of the Companies Act. 2013 and the Rules made thereunder and the Securities and જે તા. ૨૧-૧૦-૧૯૭૮ ના રોજ રજીસ્ટર થયેલ છે, સદર સોસાયટી દ્વારા અમોને Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Subsequent to the issuance of the Notice of 48th AGM, the GoG, Finance Department vide it ના એવા શેર નંગ ૫ તારીખ ૧-૨-૧૯૮૧ ના રોજનું ફાળવેલ છે સદર અસલ શેર office order no. FD/AOD/e-file/4/2022/1869/A (BPE) dated September 10, 2024, has appointed Dr. T. Natarajan, IAS (DIN: 00396367) Principal Secretary, Finance Department as a Director on Board of the Company, w.e.f. from September 11, 2024 and until further orders, vice Shri J.P. Gupta, IAS.

> Pursuant to Section 160 of the Companies Act, 2013 read with Rule 13 the of Companies (Appointment and Qualifications of Directors) Rules, 2014, and other applicable provisions, the Company has received notice in writing proposing the name of Dr. T. Natarajan, IAS (DIN: 00396367) as candidate for the office of Director of the Company, for consideration at the forthcoming Annual General Meeting (AGM). The said agenda would be included in the remote &voting facility commencing from Monday, September16,2024 (09:00 AM) to Thursday, September 19, 2024 (05: 00 PM) and also in the e-voting facility available during the AGM, for members to

> Accordingly after due compliance of applicable laws, an addendum to the Notice of 48th AGM for additional agenda as Special Business at Item No. 7 i.e. proposal for appointment of Dr. T. Natarajan, IAS (DIN: 00396367) as a Director, along with Statement pursuant to Section 102 of the Act, has already been sent electronically to those Members of the Company whose email addresses are registered with Company/Depository Participant (DP), as on the cut-off date and it shall form an integral part of the original Notice dated August 13, 2024 of 48th AGM of the Company and the notes provided therein, for all purposes.

> The said addendum is also available on the Company's website i.e. www.qnfc.in, website of the Stock Exchanges, i.e. BSE Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and website of CDSL at www.evotingindia.com

> > For Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

રદ કરી શકશે.ટોલ ફ્રી નંબર- ૧૯૧૬ ઉપર પીવાના પાણી સંબધીત ફરીયાદ નોંધી Place: Bharuch

Date: September 13, 2024

ઝોનલ ઓફિસ સુરત, રીદ્ધિ શોપર્સ, સ્ટાર બજાર સામે, અડાજણ હજીરા રોડ, સુરત. ફોન નં. 0261-2797700. મો. 9525444438 | E-mail : zo.surat@ucobank.co.in

ઈ-હરાજીથી વેચાણ તા. 30-09-2024

સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટની કલમ 13(2) અને અન્વયે યુકો બેંકના અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ ખાતેદારોને બેંકના નીચે દર્શાવેલ લેણાં વ્યાજ સહિત વસુલ કરવા નોટીસ આપેલ, પરંતુ પછીથી લેણાં ચુકવવામાં નિષ્ફળ રહેતા તેમની મિલકતનો કબજો લઈ લીધો છે અને તે મિલકત 'જેમ છે, જ્યાં અને જે છે તેમ છે'ના ધોરણે વેચવાનો અધિકાર ધરાવે છે. જેથી બેંકના લેણાં અને વ્યાજ, અન્ય ખૂર્ચા જે કર્મો કર્મા કરી શકાય. આ અંગે બેંકના નાણાં વસુલ કરતા સરફેસી એક્ટની કલમ 13(4) હેઠળ અને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ફલ્સની કલમ સાથે વંચાણે લેતા મળેલ સત્તાની રૂએ તે મિલકત વેચવા માંગે છે. આ રેચાંણ ઈ-હરાજી પ્લેટફોર્મથી વેબસાઈટ ebkray .in પર કરવામાં આવર્શે

અ.	કરજદાર/	મિલકતની વિગત	બાકી નીકળતી રકમ	અનામત કિમત	શાખાનું નામ/IFSC કોડ,
નં.	જામીનદારનું નામ		કબજાનો પ્રકાર	અર્નેસ્ટ મની ડીપોઝીટ	એકાઉન્ટ નં., સંપર્ક
04.	સરાફત શમશાદ પઠાણ	તમામ ભાગ અને હિસ્સા સહિત ફ્લેટ જે શ્રી સરાફત શમશાદ પઠાણના નામે સ્થિત કોન્વેયન્સ ડીડ નં. 3039 તા. 14- 03-2019, ફ્લેટ નં. D/1004, દસમો માળ, ટાવર D 216 MIG1, ગુજરાત હાઉસીંગ બોર્ડ મુખ્ય મંત્રી યોજના, આકાશગંગા સોસાયટી પાસે, ગોરવા, વડોદરા, માપ 65.00 ચો.મી. બિલ્ટ અપ એરિયા, રેવન્યુ સર્વે નં. 230/P, 233, 234/1, 234/2, 234/3, 235 અને 236, મોજે ગામ ગોરવા, રજીસ્ટ્રેશન જીલ્લો વડોદરા.	રૂા. 22,13,026.53/- પ્રત્યક્ષ	રૂા. 22,40,000/- રૂા. 2,24,000/-	અલ્કાપુરી UCBA0001953 19531015020019 0265-2334566 M-8340277926 M-9430023818

સંપર્ક વિગતો અને સેવા પ્રદાતા વેબસાઇટ સરનામું, મિલકત સંબંધિત કોઈપણ અન્ય ક્વેરી, ઝોનલ ઓફિસનો સંપર્ક કરી શકે છે. સંપર્ક નં. : 0261-2797700, ઈ-મેઈલ : zo.surat@ucobank.co.in સોમવારથી શનિવાર કામકાજના સમય (સવારે 10:00 થી સાંજે 05:00 કલાક) દરમિયાન બેંક રજાના દિવસ સિવાય સંપર્ક કરી શકે છે.

ઈ-હરાજીની શરતો અને નિયમો : 1. ઈ-હરાજીની વધુ શરતો માટે બીડરોએ તેમની ઓફર મોકલતા પહેલા અને ઈ-હરાજીમાં ભાગ લેતા પહેલા બેંકની વેબસાઈટ cokray .in અથવા લેવી. 2. ભાગ લેનાર બીડર્સ પાસે માન્ય એક્ટીવ ઈમેઈલ આઈડી અને પાન કાર્ડ હોવ જરૂરીછે. 3. નીચે સહી કરનાર કોઈપણ જાતના કારણ કે નોટીસ આપ્યા વિના ઓફરો સ્વીકારવાનો, નકારવાનો, પાછળ ધકેલવાનો કે બાકી રાખવાનો/વેચાણ રદ કરવાનો, નિયમો અને શરતોમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ હક્ક અબાધિત રાખે છે. 4. વેચાણ સરફેસી કાયદ નિયમો 2002 અને ઉપર જણાવેલ શરતોને આધિન રહેશે. 5. સફળ બિડરોએ ખરીદ કિંમતના 25% (પહેલેથી ચુકવેલ ઈ.એમ.ડી. સહિત) ઈ-હરાજીની પ્રક્રિયા પુરી થયે તે જ દિવસે ભરવાના રહેશે. ખરીદ કિંમતના બાકી 75% રકમ વેચાણ અંગેની પૃષ્ટી આપ્યાના 1 દિવસમાં ભરવાના રહેશે. જેમાં કસુર થયે ડિપોઝીટ જન્ત થશે અને કસુરવાર ખરીદનાર મિલકત અંગેના તમામ કે અન્ય ભાગ માટે ત્યાર બાદ દાવો કરી શકશે નહીં. 6. અસફળ બિર્ડ્સને ઈ.એમ.ડી. રકમ વેચાણ પ્રક્રિયા પુરી થયે પરત કરવામાં આવશે. 7. વેચાણ બેંકના પૃષ્ટીને આધિન રહેશે, જો દેવાદાર (રે))/જામીનદાર (રે) વેચાજ્ઞ પહેલા પુરી રકમ ચુકવશે તો વેચાજ્ઞ રદ કરવામાં આવશે. 8. મારફત દેવાદાર (રે))/જામીનદાર (રે))ને નોટીસ આપવામાં આવે છે કે, ઉપર જ્જ્ઞાવેલ લોનર્નો સંપૂર્ણ રકમની બાકી ચુકવણી હરાજીની તારીષ્ પહેલા ન થશે તો હરાજીની પ્રક્રિયા ઉપર જણાવેલ તારીખે હાથ ધરવામાં આવશે. ૭. ઓનલાઈન બીડ ભરવાની છેલ્લી તારીખ : તા. 27-09-2024 સાં જે : 04.00 કલા કે સુધી રહેશે. 10. બિડ રજૂ કરવાની કિંમત રિઝર્વ પ્રાઇસથી ઉપરની હોવી જોઇએ અ

બોલી વધારાની કિંમત રૂા. 10,000/- રહેશે. 11. ટીડીએસ જો લાગુ પડે તો બીડરે ચુકવવાનું રહેશે. તા. 13-09-2024 | સ્થળ : સુરત-યુકો બેંક. સહી/- અધિકૃત અધિકારી, યુકો બેંક









Chetna Dharajiya

Company Secretary & CM (Legal)



